



વડોદરા મહાનગર સેવા સદન

www.vmc.gov.in, www.vmcgov.com



પ્રધાનમંત્રી આવાસ યોજના

“સૌના માટે ઘર”

વડોદરા શહેર ભારત સરકારની આવાસ યોજના હેઠળનું મિશન સીટી છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક વારસાનું કેન્દ્ર બિંદુ એવું વડોદરા શહેર સ્માર્ટ સીટીની હરીફાઈમાં અગત્યની હરોળમાં સ્થાન પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે. ત્યારે ભારત સરકાર દ્વારા આરંભ કરવામાં આવેલ “પ્રધાનમંત્રી આવાસ યોજના” હેઠળ એક મહત્વકાંક્ષી નીતિ નિયમો સહના પ્રોજેક્ટનું અમલીકરણ કરવાનું છે. જેમાં સને ૨૦૨૨ સુધીમાં આઝાદીના પંચોત્તેરમાં વર્ષની ઉજવણી શરૂ થાય ત્યાં સુધીમાં દરેકની પાસે આવાસ હોય એવા લક્ષ્યાંક સાથેની આ યોજનામાં વડોદરા શહેરના રહીશ તરીકેના તેમના રહેઠાણના આધારભૂત પુરાવા સહ નીચે મુજબની જુદી જુદી યોજનામાં રસ ધરાવતા લાભાર્થી માટે નિયત કરેલ ફોર્મ મેળવી વિગતો ભરીને નીચે જણાવેલ કચેરીના સરનામે સમય મર્યાદામાં રૂબરૂ જમા કરાવવા જણાવવામાં આવે છે.

અરજીપત્રક ભરવા માટેના પાત્રતાના નિયમો.

(અ) EWS કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩ લાખ સુધીની રહેશે.

(બ) LIG કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩ થી ૬ લાખ સુધીની રહેશે.

(ક) વડોદરા શહેરના રહીશ હોવા જોઈએ.

(ડ) સમગ્ર ભારત દેશમાં અરજદારશ્રી કે તેમના સભ્યના નામે કોઈ આવાસ/મિલકત હશે તેઓ અરજી કરી શકશે નહીં.

(ઘ) સરકારશ્રીની કોઈ પણ એક જ યોજનામાં અને એક જ વાર લાભ મળી શકશે.

અરજી કરવા માટેની મહત્વકાંક્ષી યોજનાઓ.

૧) EWS અને LIG યોજના હેઠળ આવાસ માટેની લોન મેળવવા ઇચ્છતા લાભાર્થીઓને કેડીટ લીક યોજના હેઠળ લોન પર ૬.૫% ના દરથી ૧૫ વર્ષ અથવા લોનની મુદત બે માંથી જે ઓછું હોય તે મુજબ સબસીડીનો લાભ મળવાપાત્ર રહેશે. વ્યાજ સબસીડીની ગણતરી (NPV) નેટ પ્રેઝન્ટ વેલ્યુના ૯% રાહત દર મુજબ ગણાશે.

૨) એફોર્ડેબલ હાઉસિંગ (પોસાય તેવા આવાસ) સરકાર દ્વારા અથવા પ્રાઇવેટ બિલ્ડર દ્વારા બાંધવામાં આવેલ હોય તેવી આવાસ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા લાભાર્થીઓને રૂ. ૧.૫૦ લાખ સુધીની સબસીડી/સહાય મળશે.

૩) વ્યક્તિગત રીતે EWS યોજના હેઠળ ૩૦ ચો.મી. ના કારપેટ એરીયા મુજબ નવીન બાંધકામ કરવા ઇચ્છતા અથવા હયાત મકાનમાં વધારાનું કામ કરવા માટે લાભાર્થીઓને સરકારની રૂ. ૧.૫૦ લાખ સુધીની સહાય મેળવવા ઇચ્છતા લાભાર્થીઓ અરજી કરી શકશે.

નોંધ:- આ ફોર્મ માંગણી સર્વે માટે જ છે. પોલીસીના નિયમ મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીએ ફાઇનલ થયા બાદ નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.

જાહેરાત પ્રસિધ્ધ થયેથી ૧ મહિનાની અંદર અરજી કરવાની રહેશે.

અરજી ફોર્મ વિનામુલ્યે જે તે વિસ્તારની નજીકની વોર્ડ ઓફિસમાં તા. ૧૪/૯/૧૫ થી સવારના ૧૧ થી ૫ દરમિયાન મળી શકશે. તદ્દપરાંત www.vmc.gov.in વેબસાઇટ પરથી મેળવી ભરીને જરૂરી સાંઘનિક કાગળોની નકલ સહ જે તે વોર્ડ ઓફિસમાં જમા કરાવવાના રહેશે.

વધુ માહિતી માટે નીચેની કચેરીના સરનામે ગ્રાઉન્ડફ્લોર પર રૂમ નં. ૧, ઓફીસ ટાઇમમાં રૂબરૂ આવી સંપર્ક કરવા વિનંતી છે.

સરનામું : કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન,

કન્યા શાળા નં. ૩, પ્રતાપ રોડ, રાવપુરા, વડોદરા - ૩૯૦ ૦૦૧

પી.આર.ઓ.નં. ૫૫૦/૧૫-૧૬

મ્યુનિસિપલ કમિશનર



વડોદરા મહાનગર સેવા સદન
પ્રધાનમંત્રી ગૃહ યોજના અંતર્ગત
આવાસ મેળવવા માટેની અરજી પત્રક (વિના મુલ્યે)



વડોદરા શહેરમાં બનાવવામાં આવનાર ફ્લેટ ટાઇપ મકાનોમાં સર્વે માટેનું અરજીપત્રક

પત્નીનો
હાલનો ફોટો

પતિનો
હાલનો ફોટો

1. અરજદારનું પુરું નામ : (૧) પત્ની
(અટક પહેલા લખવી) (૨) પતિ
2. અરજદાર પતિ / પિતાનું નામ :
3. વડોદરા ખાતેનું હાલનું સરનામું આધારભુત પુરાવા સાથે :
(રેશન કાર્ડ/લાઇટ બીલ/ઇલેકશન કાર્ડ/આધાર કાર્ડ/અધિવાસનો મામલતદારનો દાખલો)
.....
કેટલા વર્ષથી રહે છે.
4. કાયમી રહેઠાણનું સરનામું આધારભુત પુરાવા સાથે :
(રેશન કાર્ડ/લાઇટ બીલ/ઇલેકશન કાર્ડ/આધાર કાર્ડ/અધિવાસનો મામલતદારનો દાખલો)
.....
5. જ્ઞાતિ / પેટા જ્ઞાતિ :
6. જન્મ તારીખ તેમજ ઉંમર (વર્ષમાં) : પોતે (પત્ની / પતિ) :
(પતિ/ પિતા) :
7. નોકરી / ધંધાની વિગત સરનામા સહિત :
8. આવક મર્યાદા EWS બાંધકામનું ક્ષેત્રફળ માટે ૩ લાખ સુધી : ૩૦ ચો.મી.
આવક મર્યાદા LIG બાંધકામનું ક્ષેત્રફળ માટે ૩ થી ૬ લાખ સુધી : ૬૦ ચો.મી.
9. ફોન નંબર / મોબાઇલ નંબર
10. આધાર કાર્ડની નોંધણી નંબર (૧) પત્ની
(૨) પતિ
11. કુટુંબના સભ્યો તથા કુલ વાર્ષિક આવકની વિગત (મામલતદારનો આવકનો દાખલો) :

સ્થળ : વડોદરા

તારીખ :

નોંધ : ઇલેકશન કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક તેમજ અન્ય જરૂરી દસ્તાવેજની નકલ આ સાથે સામેલ કરવા.